



AG-1240

Seat No. _____

First Year B. A. (Non CBCS) Examination

February – 2016

Economics : Paper - I (Optional - II)

(Principles of Economics)

(New Course)

Time : 3 Hours]

[Total Marks : 100

સૂચના : (૧) દરેક પ્રશ્નના ગુણ સરખા છે.

(૨) જરૂર જણાય ત્યાં આકૃતિ દોરો.

(૩) આંતરિક વિકલ્પના આધારે બધા પ્રશ્નોના ઉત્તર આપો.

૧ અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સમજાવો. ૨૦

અથવા

૧ (અ) એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. ૧૦

(બ) અર્થશાસ્ત્રના નિયમોનો અર્થ સ્પષ્ટ કરી તેની લાક્ષણિકતાઓ વર્ણવો. ૧૦

૨ પ્રો. રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યાની ટીકાત્મક ચર્ચા કરો. ૨૦

અથવા

૨ “ભાંગ અને પુરવઠો સંયુક્ત રીતે કિંમત નક્કી કરે છે” - આકૃતિ વડે સમજાવો. ૨૦

૩ ઘટતા મળતરનો નિયમ ઉદાહરણ અને આકૃતિની મદદથી સમજાવો. ૨૦

અથવા

૩ (અ) વાસ્તવિક વેતનને અસર કરતાં પરિબળો જણાવો. ૧૦

(બ) વ્યાજના દરને અસર કરતાં પરિબળો સમજાવો. ૧૦

૪	વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત સમજાવો.	૨૦
અથવા		
૪	(અ) સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો આંતરસંબંધ તપાસો.	૧૦
	(બ) “નફો એ નવપ્રવર્તનનું પરિણામ છે.” - ચર્ચો.	૧૦
૫	ટૂંકનોંધ લખો : (કોઈ પણ બે)	૨૦
	(૧) વૈકલ્પિક ખર્ચ.	
	(૨) આભાસી ભાડું.	
	(૩) એકમ વિકાસના લાભો.	
	(૪) આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ.	

ENGLISH VERSION

Instructions : (1) All questions carry equal marks.
 (2) Draw diagrams wherever necessary.
 (3) Answer all questions on the basis of internal option.

1 Explain the nature and scope of economics. 20

OR

1 (a) Differentiate clearly micro-economics and macro-economics. 10

(b) Clarify the meaning of the law of Economics and describe their features. 10

2 Examine critically the definition of economics as given by Prof. Robbins. 20

OR

2 "Demand and supply jointly determine the price" - Explain with a diagram. 20

- 3** Explain the law of diminishing returns with the help of illustration and a diagram. **20**

OR

- 3** (a) Explain the factors effecting real wage. **10**
(b) Discuss the factors affecting interest rate. **10**

- 4** Explain the marginal productivity theory of distribution. **20**

OR

- 4** (a) Examine the inter-relations between average cost and marginal cost. **10**
(b) "Profit is a reward of Innovation" - Explain it. **10**

- 5** Write short notes : (Any two) **20**

- (1) Opportunity cost.
(2) Quasi Rent.
(3) Internal economics of firm.
(4) Economic activity and non-economic activity.
-